



કોચ

દેવતા મેચ



મેચ 10

દેવતા વિ. ઉદાસીનતા

બાઈબલની વાર્તા: સદોમ અને
ગોમોરાહ જુનેસિસ 18:16-33
મેમરી વર્ગ: યોબ 6:14



→ “હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે.”



રીંગ માં

પ્રાર્થના કરો અને ભગવાનને આ અઠવાડિયે તમારા હૃદયમાં જુસ્સો વધારવાનું કહો. અન્ય લોકો માટે તમારી ઉલ્કટતા વધારવા માટે તમે અન્ય લોકો માટે કરી શકો તેવું કંઈક તપાસો. કોઈ મંત્રાલયની મુલાકાત લો અને તેઓ શું કરી રહ્યા છે તે વિશે જાણો, અન્ય લોકોને ખવડાવતા આશ્રયસ્થાનમાં મદદ કરો અથવા સમગ્ર વિશ્વમાં જરૂરિયાતો વિશેના વિડિઓ જુઓ. જ્યાં તમે લઈ શકો ત્યાં ભાગ લો.

સ્વાગત છે આપનું "ચેમ્પિયન્સ આત્માના ફળ દ્વારા" માં! તમારો ધ્યેય છે તમારા વિદ્યાર્થીઓને ચેમ્પિયન બનવામાં સહાય કરવાનો. આમ કરવા માટે, તેઓને દૈનિક જીવનમાં આત્માના ફળને કાર્યકારી રૂપમાં મૂકવાની જરૂર છે. મોટાભાગના રવિવાર સ્કૂલના કાર્યક્રમો ચર્ચમાં હોય છે, અને અઠવાડિયા દરમિયાન હોમવર્કની જરૂર હોતી નથી. જો કે, તમારા વિદ્યાર્થીઓ તેના વિશે શીખીને તેમના જીવનના પાપોને "હરાવી" શકતા નથી. તેઓએ ખરેખર "રિંગના અંદર" આવવું પડશે અને અઠવાડિયા દરમિયાન તેઓ જે વાસ્તવિક પાપનો સામનો કરશે તેની સામે લડવું પડશે. પ્રમાણિકપણે, અને વિષે તપાસ કર્યા વિના, આ કરવું લગભગ અશક્ય બનશે. કૃપા કરીને "તેમના શબ્દ પર વિશ્વાસ કરશો નહીં" અને સ્વીકારી ના લેશો જ્યારે વિદ્યાર્થીઓ કહે કે તેઓએ એસાઇનમેન્ટ કરી લીધું છે. જો તમે આ પ્રોગ્રામ વિશે ઢીલા પડશો, તો તમે તમારા વિદ્યાર્થીઓને તમને જૂઠું બોલવા માટે તાલીમ આપી શકશો. જો કે, મારી સાથે કલ્પના કરો કે જો તમે ખરેખર તમારા વિદ્યાર્થીઓને કોચિંગ આપી શકો છો, અને ટ્રેક કરી શકો કે તેઓ હોમવર્ક કરી રહ્યા છે, તો તમે તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન જોશો. ફક્ત એક જ વર્ષમાં, તમે તેમની જીંદગીમાં પરિવર્તન લાવી શકો છો! તમારા વિદ્યાર્થીઓ આત્માના ફળને યાદ રાખશે નહીં, પરંતુ વાસ્તવમાં તેને જીવવાનું શીખશે! તમારી જવાબદારીઓ:

- 3-5 બાળકોને કોચિંગ આપે
- વિદ્યાર્થીઓ સાથે એસાઇનમેન્ટની ચર્ચા કરવા માટે અને ચેમ્પિયન્સ બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર અઠવાડિયે ક્લાસ પહેલા અને પછી 5 મિનિટ માટે વિદ્યાર્થીઓને મળો.
- એસાઇનમેન્ટની યાદ અપાવવા માટે દર અઠવાડિયે વિદ્યાર્થીઓને કૉલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = મંગળવાર)
- પૂર્ણ થયેલ એસાઇનમેન્ટનો રિપોર્ટ મેળવવા માટે અઠવાડિયે બીજી વાર વિદ્યાર્થીઓને કૉલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = શુક્રવાર)
- નાના જૂથના બાળકો માટે કરવામાં આવેલ એસાઇનમેન્ટનો ટ્રેક રાખો અને હેડ કોચની દર અઠવાડિયે જાણ કરો.

પુરસ્કારો:

કોચ બનવાનો મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમારા વિદ્યાર્થીઓને વિજેતાઓ જેવો હેષા આપવો. આનો અર્થ એ છે કે તમે જે વર્તનની અપેક્ષા રાખી રહ્યા છો તેને તમારે વ્યાખ્યાયિત કરવાની અને તે વર્તનને પુરસ્કાર આપવાની જરૂર છે.

નાના-નાના સાપ્તાહિક પુરસ્કારો:

- હગ (આલિંગન)
- હાઈ-ફાઈવ્સ
- તેમના શર્ટ પર સ્ટીકર
- હાથ પર સ્ટેમ્પ
- નાની કેન્ડી

મહિનાના અંતે મોટા પુરસ્કારો:

- બાળકોને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો આપવાના પુરસ્કાર સમારોહ. (3 અઠવાડિયાના એસાઇનમેન્ટ માટે કાંસ્ય, 4 અઠવાડિયા માટે રજત, અને 5 અઠવાડિયા માટે સુવર્ણ ચંદ્રક. વૈકલ્પિક રીતે, તમે 2 પંચ માટે કાંસ્ય, 3 પંચ માટે રજત અને અઠવાડિયામાં 4 પંચ માટે સુવર્ણ પણ આપી શકો છો.)
- તમારા ઘરે એક પાર્ટી
- પ્રમાણપત્રો
- ચર્ચમાં પુખ્ત લોકોની સામે ચર્ચમાં કંઈક મોટું આપવું
- ટ્રોફી

તમારા વિદ્યાર્થીઓને આત્માના ફળમાં કોચિંગ કરવાના પડકારમાં આપણા ઈશ્વર તમને પ્રેરણા આપે એવી શુભેચ્છા!



મેચ 11

ભલાઈ વી. દુષ્ટતા

બાઈબલની વાર્તા: હેરોદ અને જહોન બાપ્ટિસ્ટ

લ્યુક 3:18-20, મેથ્યુ 14:1-12

મેમરી વર્ડ:

ગીતશાસ્ત્ર 34:14



"દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો."



રીંગ માં

દુષ્ટતાની હાજરી જોવા માટે તમારી આસપાસ જુઓ, જ્યાં કોઈ વ્યક્તિ દેખીતી રીતે કોઈ કારણસર બીજાને દુખ પહોંચાડે છે. આ અઠવાડિયે નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે દરમિયાનગીરી કરવાનો માર્ગ શોધો. કદાચ તેમને શાળામાંથી અલગ રસ્તે ઘરે જવામાં મદદ કરો, લંચ પૂરું પાડો, અથવા તેમની સાથે ચાલવામાં 4 નું જૂથ તમારી સાથે જોડો.



મેચ 12

ભલાઈ વિ સ્વાર્થી મહત્વાકાંક્ષા

બાઈબલની વાર્તા: ટાવર ઓફ બેબલ

જોનેસિસ 11:1-9

મેમરી વર્ડ: ફિલિપીઓને પત્ર 2:3



"સ્વાર્થી મહત્વાકાંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો."



રીંગ માં

તમારી ખ્યાતિ અથવા લોકપ્રિયતા વધારવા માટે આ અઠવાડિયે કંઈ કરશો નહીં. દર વખતે જ્યારે કોઈ તક ઊભી થાય છે, તેને ફેરવી દો. જેમ તમે આ કરો છો, તમે આ ખૂબ જ નીચ પાપને મુક્કો મારશો.



મેચ 13

ભલાઈ વિ અશુદ્ધતા

બાઈબલની વાર્તા: જોસેફ અને પોટિફર

જોનેસિસ 39:1-21

મેમરી વર્ડ:

થેસ્સાલોનિકિઓને બીજો પત્ર 1:11



"એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં કમ કરવા માટે તમારી સર્વ ઈચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો."



રીંગ માં

આ અઠવાડિયે તમારા હૃદયનું ધ્યાન રાખો. જો તમારી વિરુદ્ધ કંઈક કરવામાં આવ્યું હોય, તો યાદ રાખો કે પાપ તેઓ કરે છે, તમે નહીં. દરરોજ પ્રાર્થનામાં કહો, "હું તમારી સમક્ષ શુદ્ધ છું, ભગવાન." જો તમે બીજા કોઈની વિરુદ્ધ કંઈક કર્યું હોય, તો તે વ્યક્તિ અને ભગવાનની માફી માંગવી. પછી તમે પ્રાર્થના કરતાં રહી શકો છો, "હું તમારી સમક્ષ શુદ્ધ છું, ભગવાન."



વિદ્યાર્થીઓ



1

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

2

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

3

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

4

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

5

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

6

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

